

શ્રી અશોવિજયલ

દેન ગંથમાળા

દાદાસાહેબ, લાયનગર.

ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨

૩૦૦૨/૫૬

1835

શ્રી અચલ ગરુદેશ્વર શ્રી મહેન્દ્રસિંહસુરિ

વિનયોગ

~

શ્રી અટોટરી તીર્થમાળા



: જ્યોતિ પ્રસિદ્ધ કરનાર :
લક્ષ્મીચંદ કુંવરજી નાગડા.
૨૮૮, તરસી નાથા સ્ટ્રીટ,
મુંબઈ નં. ૫.



મુખ્ય : અમુખ્ય.

શ્રી અચન્ત ગાંધેશ્વર શ્રી મહેન્દ્રસિંહસુરિ
વિરાચિત

શ્રી અષ્ટોતરી તીર્થમાળા



શ્રી અચન્ત ગાંધેશ્વર :
લક્ષ્મિભયં કુંબરણ નાણડા.
૨૮૮, નરસી નાથા સ્ટ્રીટ,
મુંબઈ નં. ૬૦.



મુખ્ય અમુખ્ય.

શ્રી અચલ ગરુદેશ્વર શ્રી મહેન્દ્રસિંહસૂરિ

વિરચિત

શ્રી અષ્ટોત્તરી તીર્થમાલા.

(સાર્થ)

શ્રી વિધિપક્ષગચ્છીય અણુગારસ્ય સાર્થોનિ વિધિ સહિતાનિ પંચપ્રતિકમણું સ્વત્રાણિ ચતુર્વિધસંધને ભણવા વાંચવાને અર્થે વિધિપક્ષ સમાચારી અનુસાર તૈયાર કરનાર મુનિમહારાજ શ્રી ગૌતમ સાગરજીની આજાથી છપાવી પ્રસિદ્ધ કરતા શેડ લાલજી પુનશી ઠે: ભાતબજર, મુંખધ આ મોટા પુસ્તકમાં પ૫ માં પાનાથી શરૂ થતી શ્રી અચલગરુદેશ્વર શ્રી મહેન્દ્રસિંહસૂરિ વિરચિત શ્રી અષ્ટોત્તરી તીર્થમાલા અર્થ સહિત છપાવી છે. તે પુસ્તક કદમાં મોટું છે તેમાંથી ઇકત અષ્ટોત્તરી તીર્થમાલાં અર્થ સહિત અક્ષરશઃ કાંઈપણ ફેરફાર કર્યાવિના નાની પુસ્તકાદ્યુપ કરવાના ધરાદાથી આ સુપ્રયત્ન કરવામાં આવે છે, આ નાનું પુસ્તક એકજ તીર્થમાલાના અર્થ પૂર્વક થાય તો નાના નાના બાલકો તથા બાળકાઓ તેમજ મોટી ઉમરના પણ સુશ્રાવક શાવિકાઓ અર્થ વાંચી લાલ લદ શકે. આ મોટા પુસ્તકમાં તીર્થમાલાની અનુકમણિકા નથી તો તેની અનુકમણિકા એક સુવિહિત મુનિઓ તૈયાર કરી છે. તેની અનુકમણિકા આ પ્રમાણે—

આ તીર્થમાણાની માગધ ગાથાઓ એકસોઅગીબાર (૧૧૧) છે તેમાંથી પ્રથમ ગાથાથી માંડીને અગીબાર ગાથાસુધી સામાન્ય રીતે જિનેશ્વર પ્રબુની સ્તુતિ વર્ણવી છે તેમજ આરમી તેરમી ચોદમી અને પંદર સુધીની ગાથામાં ભૂતકાળની ચોવિસી વર્ણવી છે. તથા સોળમી સત્તરમી અને અઢારમી એમ ત્રણ ગાથામાં વર્તમાન ચોવિસી તેમ એગણીઝ, વીજી

એકવીસ, બાવીસ, એ ચાર ગાથામાં ભાવિય જિન ચોાવિસ્થિની
 નામોપૂર્વક સ્તુતિ છે. તેમજ સત્તાવિસ, અહૃતીઅ, એ એ
 ગાથામાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિપ અને વૈમાનિક, તીર્થોની
 સામાન્ય સ્તુતિ છે, ઓગણુત્રીસ, ગ્રીસ, એ એ ગાથામાં એક
 એકશાખતા મંદિરમાં એકસોએંશી (૧૮૦) પ્રતિમાએ તેમજ કેછિ
 મંદિરમાં એકસોચોવિસ (૧૨૪) પ્રતિમાએ તેમ કેછિ
 મંદિરમાં એકસોવીસ (૧૨૦) પ્રતિમાએ કેવીરીતે હોય તેનું
 વર્ણન કરેલું છે. તેમજ એકગ્રીસ અને બર્ગસમાં વણ દ્વાકના
 જિનમંદિરની પ્રતિમાં જે છે. તેની સંખ્યા બતાવી છે. તેવીસમી
 ગાથામાં ચાર શાખતી પ્રતિમાઓના નામો આવે છે. તેમજ
 ચોત્રીસમી અને પાંત્રીસમી એમ એ ગાથામાં ઉલ્કુદ્રા એકસો
 સિ-તેર (૧૭૦) તીર્થિકરની વર્ણાદિ ચુક્ત સ્તુતિ છે. તેમજ
 છત્રીસ, સાડગ્રીસ, આડગ્રીસ, ઓગણુચાતીસ, એ ચાર ગાથામાં
 વિષ વિહુરનાન જિનની સ્તુતિ છે. ચાદીસમી ગાથામાં વણ-
 કાળના જિનેની સ્તુતિ તેમજ એકતાતીસમી ગાથામાં અપ્રા-
 પદાર્થ સાત તિર્થોના નામો છે તેમજ એંતાતીસ, તેંતાતીસ,
 ચુમાલીસ, અને પિસ્તાતીસ એ ચાર ગાથામાં શ્રી અષ્ટાપદ
 તીર્થની સ્તુતિ છે. છેંતાતીસ, સુડતાતીસ અને અડતાતીસ,
 એમ વણ ગાથામાં જિરનારજી તીર્થની સ્તુતિ છે. ઓગણુ-
 પચાસમી ગાથામાં ગજાયપદ તીર્થની સ્તુતિ છે. પચાસમી;
 એકાવનમી, બાવનમી, ત્રેપનમી, ચોપનમી ને પંચાવનમી
 એમ છ ગાથામાં દશાર્ણભદ્રરાજનો મદ ઉતારવા ઠન્ડમણુરાજે
 સમૃદ્ધ વિકુર્વિ અને ત્યાં ગજાયપદનામનું પર્વત ઉપર તીર્થ
 થયું. છપનનીગાથામાં ધર્મચક્ર તીર્થની સ્તુતિ છે. આ સ્થાન
 શ્રી બાહુણદીથી પ્રગટ થયું છે. ઓગણુસાડ, સાડ, એકસઠ,
 બાસઠ, ત્રેસઠ એમ પાંચ ગાથામાં પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થોનું
 વર્ણન કરેલું છે. તેમજ ચોસઠ, પાંસઠ, છાસઠ, એમ વણ
 ગાથામાં રથાવર્ત પર્વત નામનું તીર્થ છે. જ્યાં વજસ્વામિનું
 મહુરાજે અણુસ્તન કર્યું હતું ત્યાં સૌધર્મેન્દ્ર મહારાજ વંદન

કરવા આવ્યા તેથી આ તીર્થ પ્રગત થયું. સાણુસ્કડ અને અણુ-
 સડમી ગાથામાં ચમરોત્પાત તીર્થની સ્તુતિ છે. અગણો-તેરમી
 ગાથામાં અષ્ટાપદાહિ સાત તીર્થની જામન્ય સ્તુતિ છે. ગ્રી-તેર
 અને ઈકો-તેરમાં શ્રી ભમેત શિખર તીર્થની સ્તુતિ છે. તેમજ
 બોતેર, તોતેર, ચમો-તેર અને પંચો-તેર એમ ચાર ગાથામાં
 શ્રી શનુંજ્ય તીર્થની સ્તુતિ છે. છોતેરમી ગાથામાં મધુરા-
 નગરીમાં સુપાર્વનાથ નામનું તીર્થ છે તેની સ્તુતિ કરેલી છે.
 સલ્યો-તેરમી, અઢ્યો-તેરમી; ઓગણ્યાઓંશીમી અને એંશીમી
 ચેમ ચાર ગાથામાં શ્રી લડ્ય તીર્થની સ્તુતિ છે. એકાચીમી
 ગાથામાં ખંલાત નગરે સ્થાંખણ પાર્વનાથ તીર્થની સ્તુતિ છે.
 વ્યાસીમી ગાથામાં પાડલ ગામ તીર્થ શ્રી મહાવીરજિન સ્તુતિ
 છે તેમ આ ગાથામાં શ્રી શંખેશ્વર તીર્થની સ્તુતિ પણ આવે
 છે. લ્યાસીમી ગાથામાં થારકર હેઠે ગુડરગિરિ તીર્થની સ્તુતિ
 આવે છે. ચોરાસીમી ગાથામાં સુરાચંદ્ર આહિ તીર્થની સ્તુતિ
 આવે છે. પંચાચીમી ગાથામાં સત્યપુરીમાં શ્રી મહાવીરજિન
 તીર્થ સ્તુતિ છે. છયાચીમી ગાથામાં જવલીપુરમાં શ્રી મહા-
 વીરજિન તીર્થ છે. સલ્યાચીમી ગાથામાં યક્ષવસ્તિ (સોવનગિરી)
 તીર્થ સ્તુતિ છે. અઢ્યાચીમી ગાથામાં જડોરગઢના પડ્હાડ
 ઉપર ચન્દ્રપ્રભુ, પાર્વનાથ તીર્થ આવેલા છે, આ તીર્થોમાં
 શ્રી કુમારપાળ રાજના કરાવેલા મંદિરો છે. નેવ્યાસીમી ગાથામાં
 ખામહણુવાડ વિરે તીર્થની સ્તુતિ છે. નેવુમાં મેવાડ હેઠે
 નાહિરામ ગામના શ્રી વીરપ્રભુ વિરાજિત છે. એકાણુંમી ગાથામ
 ચિતોગઢ તીર્થની સ્તુતિ છે. બાણું, ત્રાણું, ચોરાણું, પંચાણું
 છન્નું, સત્તાણુંમી ગાથાએમાં શ્રી આખુલ તીર્થની સ્તુતિ છે.
 અફુણું, નવાણું, એ એ ગાથામાં સુંદરણ તીર્થની સ્તુતિ છે.
 સોમી ગાથામાં શ્રી તારંગા તીર્થની સ્તુતિ છે. એકસોએકમાં
 વાયડ નગરમાં શ્રી મુનિસુત્રતસ્વામીનું તીર્થ છે. એકસોએમાં
 લિન્ધમાડ, આરાસણુપુર, ખામહણુપુર, આણુંદપુર અને પાંચમું

સિદ્ધપુર, વિંગરે તીર્થનું વર્ણન છે. એકસોનેવણુંમાં ગુજરાતેશ, માલવહેશ, કોકણહેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, પાંચાલ, મરદેશ, શાકંભરી, હરસ્તનાપુર અને શૌરીપુરી, તીર્થનું નામરૂપ વર્ણન કરેલું છે. એકસોચારમાં નિલુબનગિરીહુર્ગ તથા ગોપગિરિ (ગ્વાતીયરહેશ તીર્થ) તથા કાશી, અવંતી અને મેવાડ આદિ તીર્થોની નામરૂપ સ્તુતિ છે. એકસોપાંચમાં અઠીદ્વિષમાં ઉત્કૃષ્ટ કાળે એકસોસિ-તેર (૧૭૦) તીર્થકર હોય તેઓની નામાવલિ પૂર્વક સામાન્યથી તીર્થ સ્તુતિ કરી છે. એકસોછમાં ઘર-દહેરાસરની સ્તુતિ કરેલી છે. એકસોભાતમાં દેવ અને મનુષ્યોએ ને ફેદી પ્રતિમાળ ભરાવ્યા હોય તેની સ્તુતિ છે. એકસોઆડમાં ગ્રણુકાગના જિનોને વંદન કરેલું છે. એકસોનલવમાં શાશ્વતા અશાશ્વતા તીર્થોની સ્તુતિ છે. એકસોદશમાં પાંચકઢ્યાણુકણી ભરમિના તીર્થનું વર્ણન છે. એકસોને-અગિઅારમાં શ્રી અષ્ટોતરી તીર્થમાગાના કરનાર કવિ નવરતનનું દ્વિઅર્થ સુચક નામ આવેલું છે. એવી રીતે આ તીર્થમાગાની અનુક્રમણિકાનું વાંચન તથા મનન કરવાથી આ મહાપ્રલાભિક સ્તોત્રનું દિગદર્શન આરી રીતે થઈ શકે છે. તો ભવ્યજીવોએ આ તીર્થમાગાની સ્તુતિ તથા અર્થનું વાંચન અહેનિશ કરવું તે મહા શ્રીયસ્કર છે.

અનુક્રમણિકા નાંખુણું

॥ ખીત ॥

॥ અં શાન્તિ શાન્તિ શાન્તિ: ॥

શ્રી અચલગંગુથેથર શ્રી મહેન્દ્રસિંહસુરિ
વિરચિત

શ્રી અણોતરી તીર્થમાળા

અરિહંત ભગવાંત, સબ્બતું સંવદસિ તિર્થયરં ॥
સિજું ઘુદ્ધ નિન્ય, પરમપયંભ જિણું થુણિમો ॥ ૧ ॥

શાખાથ્રો:—

અંતરંગ શત્રુને હળુનારા, પૂજયનીક, કેવલજ્ઞાને સહિત, કેવલ-
દર્શન સહિત, શાશનને પ્રકાશ કરનારા, સંપૂર્ણ થયું છે પોતાનું
કાર્ય એવા, પોતાની મેળેજ ઓધને પામેલા, નિત્ય જ્ઞાનને પ્રાપ્ત
થયેલા, અને મુક્તિક્ષેપનને વિષે રહેલા એવા શ્રી જિનેશ્વર ભગવાનને
કર્તા કહે છે કે, અમે સેવિયે ધીમે. ॥ ૧ ॥

જય જય તિહુઅણમંગલ, ભદ્રાર્થ સામિસાલ ભયવત્તા ॥
દ્વાહિદૈ જગાઙુ, પરમેસર પરમકારણ્ય ॥૨॥

શાખાથ્રો:—

હે ત્રણ જગતમાં મદામંગલરૂપ, હે સર્વપૂજય; હે સ્વામિન,
હે વૃક્ષસમાંન ! અથવા હે પૂજય ! હે બાલ અને અંતરંગ શત્રુના
ભયથી હે દેવના અધિપતિ જેધંડ તેના પણ હેવરૂપ હે જગદ્ગુર
એટલે પ્રાણીમાત્રના ગુરૂરૂપ ! હે પરમપ્રભુ તથા હે પરમ-
દ્વારૂપ ! તમો ઉકૂલદ્વા જયવંતા વર્તો. ॥ ૨ ॥

જય જય જગિક્ષયંધવ, ભવજલહિદીવ તિહુઅણપદ્ધવ ॥
જય જય જગચિંતામણી, તિહુઅણ ચૂડામણી જિણંદ ॥૩॥

શાલ્લાર્થ:-

હે જગતના અંધવરુપ ! હે સંસાર સમુદ્રમાં કીય સમાન
ઉત્કાટા વરો. હે તણુ ભુવનને વિષે પ્રદીપ સમાન ! જગતના
જીવને ચિંતામણી સમાન ! હે તણુ જગતના મુકૃટરૂપ ! હે જિનેંદ્રા
તમો ઉત્કૃષ્ટા જ્યવંતા વરો. ॥ ૩ ॥

જ્ય જ્ય સિવપહુસંદણુ, અસરણજણુસરણ દીનઉદ્ધરણ ॥
જ્ય જ્ય ભવભયલંજણુ, જણુરંજણુ છિનજરમરણ ॥૪॥

શાલ્લાર્થ:-

હે મોક્ષમાર્ગે વારવાને રથ સમાન ! હે અશરણુ જનના
શરણરૂપ ! હે કર્મથી દુઃખી જીવોનો ઉધ્બાર કરનાર તમો ઉત્કાટા
વરો. હે સંસાર ભયના ભાંગનારા ! હે જનમાત્રને પ્રીતિનાં કરનાર
તથા હે છેદી નાંણ્યા છે જરા ને મરણ જેણે એવા હે અગ્રવાન તમે
ઉત્કાટા જ્યવંતા નરો. ॥ ૪ ॥

જ્ય કર્મજલહિ તારણુ-તરંડ ગુણરયણધારણ કરંડ ॥
જ્ય વિસમખાળુ વારણુ-વરંડ મુણિસુમણુવણુસંડ ॥૫॥

શાલ્લાર્થ:-

હે પાણ સમુદ્ર થકી તારવાને વાહાણરૂપ ! હે ગુણરૂપ રતનને
ધારણુ કરવામાં કરંડિયારૂપ ! તમે ઉત્કાટા વરો. વલી હે કામહેવનાં
આણુને વારવામાં અભતરરૂપ ! હે મુનિરૂપ પુષ્પો તેને ધારણ કરવા
થકી વનઅંડ રૂપ એવા હે પ્રલો ! તમો ઉત્કાટ વરો. ॥ ૫ ॥

ધનોહં પુણોહં, સહદો મહ એસ માણુસો જર્મો ॥
જ જિણુ તુહ પયપંક્ય-પસાય પાસાયમલિઝને ॥૬॥

શાલ્લાર્થ:-

હે જિન ! હું ધન્ય છું, તથા હું પવિત્રાત્મા છું તથા

મહારે! આ મનુષ્ય સંઅધી જાન તે સક્રિય થયો. કે કારણ માટે
તમારાં ચરણ કુમાર તેના પ્રસાહદ્વારા રાજભાવન ઉપર હું ચટેલો છું
તેથી હું કૃતર્થ થયો છું. ॥ ૬ ॥

ધત્રો એથેસા દિવસો, જામ મહુર્તો વિ એસ સુપચિત્તો ॥

જાન્મિ તુમાં તિજગ ગુડ, ભવમદ્વપહ સુરતડ પ-તો ॥૭॥

શાખાર્થ:-

હે તાથ! આ દિવસ ધન્ય છે. આ પ્રહુર, અને આ એ
વિટિક માત્ર અપિ શાખાથી બીજા પણ કાલ જાણી લેવા અત્યંત
પવિત્ર જાણ્યો. ક્યા મુહુર્ત વિગેરે પવિત્ર છે? તો કે, કે દિવસ
ધામ, મુહુર્ત અને ધરિકાદિકને વિષે તમે ત્રણ જગતના ગુરુ મને
પ્રાપ્ત થયા, તે દિવસ વિગેરે મહારાં ધન્ય છે. હવે તમો કેવા છો? તો
કે, સંસારદ્વારા મહુની તેમાં તમો કદ્વારાની સમાન છો. ॥ ૭ ॥

અહું મહું ચિંતામણી, સુરતડમુરગાનિલહકુંભાદ ॥

સયદાં સુલહું એપહું, અલદ્રપુંબો તુમાં લદ્રો ॥૮॥

શાખાર્થ:-

હે સ્વામિનું હમણાં મહારે ચિંતામણી, કદ્વારાની, કામધેનુ,
કામકુંભાહિ તે સર્વ વસ્તુ સસુદ્ધાય યુતલ થયો. યુતલ સ્વાર્થી થયોહિ
તો કે, હે પ્રલો, ખર્ચ ક્યારે પણ પ્રાપ્ત થયા નથી એવા તમો
પ્રાપ્ત થયા છો. તેથી મારે ચિંતામણી વિગેરે સર્વ મલ્યા
એવું જ થયું છે. ॥ ૮ ॥

નરયલન તિરિય નરસુર, વરસમુદ્ય નમિય ચલણુકમલહુગાં ॥

નિહુઅણજાણુ સુરતડસમ, મહુનિસમવિ નમહું તિજગપહું ॥૯॥

શાખાર્થ:-

હે ભાગ્ય જનો! તમે ત્રણ જગતના પ્રાપ્ત એવા ભગવાનૈ

દ્વારીહીનસ નિરંતર પ્રણામ કરે। વળા પ્રભુ કેવા છે ? નારકીનઃ
જીવ, એકંદ્રોયાદિક જીવ તથા મનુષ્યને વિશે અને દેવતાઓને વિશે
શ્રીચ, તેમનો જે સમૃદ્ધ તેણે નમન કર્યું છે, એ ચરણુકમળમાં.
કેવા છે ? વણુ જગતના જીવોને કદ્યપ્રકૃતસમાન સુખતાયદ છે. ॥૧૬॥

અડહસ હોરસ્ટ્રહિંદે. સહિએ ચરૂતીસ ચરદસિયવરેહિં ॥
હૃદ્યકાહે કૃયસોહે. અદ મહાપાદ હેરેહિં ॥૧૭॥

શાસ્ત્રાર્થ:-

પ્રભુ કેવા છે ? અદ્દર દોંસે કરી રહિત, ચોવીશ મતોદર
અતિથોએ કરી સહિત એવા, હંદુંથો છે કોષ નેણે, તથા
અદ મહાપ્રાતિહાર્યાએ કરેલી છે શોભા નેમની એવા છે. ॥૧૮॥

જિયરાજે જિયહોસે, જિયમેહે અડકમનિમમહુણે ॥
સિંહપુર પહુસંશાહે. ગયમાહે થામિ જિખુનાહે ॥૧૯॥

શાસ્ત્રાર્થ:-

જિત્યા છે સગદિ દોંસે નેણે એવા, જિત્યા છે કેદ્યા
દોંસે નેણે જીત્યો છે મોદ નેણે એવા, આદ કમેને નેણે નાશ
કર્યાં છે એવા તથા મોક્ષમાંગને વિશે સાર્થવાહ સમાન, ગંધ છે
કર્મધીડાદ્ય આધા નેમની એવા જિતનાથ લગતાનને હું
સ્તવું છું. ॥૨૧॥

ભરહંમિ તીયકાલે, પદમં વંદામિ કેવલિ જિખુંદં ॥
નિવ્યાણી જિખુંસાયર, મહાજસં ચેવ વિમલ જિખું ॥૨૨॥

શાસ્ત્રાર્થ:-

ભરતક્ષેત્રને વિશે અતીતકાલે થઈ ગયેલી ચોવીશાને વિશે પ્રથમ
કેવલાનામા જિનેંદ્રને હું વંદન કરું છું. તથા ભીજ નિર્ધારિનિત
ને, ગ્રીજ સાગર જિતને, ચોથા મહાયશ જિતને, પાંચમા વિમલ
જિતને. ॥૨૩॥

स-न्वाणुभृत् तिरिहुर, दत्तं दमोदरं सुतेयं च ॥
साभिजिलुं मुण्डुमुव्यय, मुभंद्र तिवगुर्त तहुच्छाहुं ॥२३॥

शा॒ष्ठ॑८०८०:-

तथा छटा सर्वानुभृतिने, सातमा श्राधर जिनते, आहमा
दत्त जिनते, नवमा दमोदर जिनते, वर्षी दशमा सुतेज जिनते,
अग्नीयारमा द्वामि जिनते, आरमा मुनिसुवत जिनते, तेरमा
सुभति जिनते, चतुर्थमा शिवर्गति जिनते, पंक्षरमा अरताच
जिनते पञ्चु हुं वंदन कड़े छुं ॥ १३ ॥

नभिमो नभीसरजिलुं, अनीलं जसेहुरं कुयत्थं च ॥
धूभीसर मुद्धमध्य, सिरकरजिलु संद्धु जिलुहुं ॥१४॥

शा॒ष्ठ॑८०८०:-

मेवमा नभिश्वर जिनते, स-तरमा अनिलने अदारमां
यशोधरने, ओगणीसमा कृतार्थने, वीशमा धर्मेश्वरने, ऐक्षीशमा
शुद्धमतिने, आवीसमा शिवकर जिनते, चेनीसमा द्यंदन जिनते दत्ते
नमस्कार करीओ छीओ. ॥ १४ ॥

संपठनामं वहे चउवीसहमं जिलुं सिवं प-तं ॥
अहुलु ओ वहुभाषे, कमेणु थुणिमो जिलुवरहे ॥१५॥

शा॒ष्ठ॑८०८०:-

मेक्षने प्राप्त थया एवा चोवीशमा संपतिनामक जिनते
हुं वंदन कड़े छुं. वर्णी उलमां वर्तमान एवा जिनवरते विषे
धन्द्र समान एवा जिनते अनुकमे करी अमे स्तविये छीओ. ॥१५॥

नभिमो रिसहुजिलुहुं, अजियजिलुं संलवं च तिथथयरं ॥
अलिनंद्धु जिलुच्यहुं, सुभंद्र पुम्भपहुं मुपासं ॥१६॥

શાખાર્થ:-

પ્રથમ શ્રી ઇવલનામા જિતને, તથા ૨ અગ્નિતજ્જિતને, ૩ સંભવનામક, તિર્થકરને, ૪ અભિનંદન નામા જિતયન્દ્રને, ૫ ચુમતિનાથને, ૬ પદ્મપ્રલુને, ૭ સુપાર્વનામા તિર્થકરને નમાયે છીએ ॥ ૧૬ ॥

ચંદ્રપહું ચ સુવિહિ, સીયલનામં જિષું ચ સિદ્ધાંસં ॥

વસુપુજાઙું વિમલં તહુ, અણુંત ધર્મં જિષું સંતિ ॥ ૧૭ ॥

શાખાર્થ:-

૧૩ ૮ ચંદ્રપ્રલુનામા જિતને, ૯ સુવિધિનાથને, ૧૦ રીતદી
નાથને, ૧૧ ઐયાંસજિતને, ૧૨ વાસુપુજ્ય જિતને ૧૩ વિમલનાથને,
૧૪ અનંતનાથને, ધર્મનાથને, ૧૫ શાંતિનામ જિતને. ॥ ૧૭ ॥

કુંધુજિષું અરનાહું, મહિલાં મુણિસુવ્યાચ નમિનાહું ॥

નોમિં પાસં વહે. ચક્રીસ દ્રિમિં ચ વીરજિષું ॥ ૧૮ ॥

શાખાર્થ:-

૧૯ કુંધુનામા જિતને, ૨૦ અરનાથને, મહિલનાથને, ૨૧
મુનિસુવતસ્વામિને, ૨૨ નમિનાથને, ૨૩, નેમિનાથને, ૨૪ શ્રી
પાર્વતાથને, ૨૫ ચોતીસમા વીર જિતને કું વંદન કરું છું.
॥ ૧૮ ॥

હવે ભાવિજિત ચોતીશીલાં નામ લઈને તેને પ્રણામ કરે છે.

સિરિ પદ્મનાહ નાહું, વંદામિ સુરદેવ તિર્થયર ॥

તઠયિં સુપાશ નામં, સયંપહુ જિષું તહુ તુરિયિં ॥ ૧૯ ॥

શાખાર્થ:-

પ્રથમ શ્રી પલનામનાથને, ૨ જીર્ણહેઠને, ત્રીજી સુપાર્વતામા

तीर्थकरने, तथा योथ. दत्तयं प्रजनामा जिनने हुं वंहन
करं छुं. ॥ २६ ॥

सम्पाणुलुकुद्देवं, हेवसुअं उद्द्यसाभि पैदालं ॥
पाहिल सयकिति जिषुं, मुषु सुव्यय अभमसाभिं च ॥ २० ॥

शास्त्रार्थः—

५ सर्वानुलुकिहेवने, ६ हेवकुननामा तीर्थकरने, ७ उद्द्यस्वाभिने
८ पैदालने, ९ पैटिवने, १० शतकार्ति जिनने, ११ मुनिमुननामा
तिर्थकरने, वगा १२ अभमस्याभिने ॥ २० ॥

पण्डिमाभि निकक्सायं, निष्पुलायं च निष्ममांतं च
सिरि चित्तगुप्तस्याभिं, समाहिजिषु शंवर जिषुं ॥ २१ ॥

शास्त्रार्थः—

१३ निःक्षायस्याभिने, १४ निष्पुलाऽग्निने, १५ निर्मभत्वने,
१६ श्रा चित्तगुप्तस्याभिने, १७ समाधि जिनने, १८ संवरजितेद्रने,
हुं प्रणाम करं छुं ॥ २१ ॥

जसहर विजयं भाष्टां, हेवुव्यायं अषुंत विरियं च ॥
चउवीस इमि लहं, इच्य लावि जिषे नमांसाभि ॥ २२ ॥

शास्त्रार्थः—

१९ यशोधर जिनने, २० विजय जिनने, २१ भवित्वजिनने,
२२ हेव नेतुं नाम छे एवा तिर्थं करने, २३ अनंतवीर्य जिनने,
योवीसमा लद्रस्याभिने, ए प्रकारे लाविजिनने एटदे आवती
योवीसीना जिनने हुं नमरकार करं छुं. ॥ २२ ॥

वह वेअहेसु, शास्य जिषुचेह्याणि सितरिस्यं ॥
तीसं वासहरेसु, वीसं गयदंतसेलेसु ॥ २३ ॥

શાખાર્થ:-

એકમો સિ-નેર વૈતાદ્યોને વિષે શાશ્વતા એકમો સિ-નેર જિન ચૈત્યોને, તથા વર્ધિંદુ પર્વત વીશના વીશ ચૈત્યને, અને વીશ ગજદંત પર્વતને વિષે વીશ ચૈત્યોને વંદન કરું છું. ॥ ૨૩ ॥

દસકૃત્રસિહુરેસુ, તેસિં અચિહ્ની વણેસુ તહ અસિદ્ધ ॥
વાંઘારગિરિસુ અસિદ્ધ, પણુસિદ્ધ મેડુપણુગમિભ ॥ ૨૪ ॥

શાખાર્થ:-

દશ કુરુક્ષણના શિખરને વિષે દશ ચૈત્યો તથા તે કૃત્રિમના પરિધિનાં વનતે વિષે એંશા ચૈત્યોને, તથા વક્ષસકાર ગિરિ એંશા છે તેને વિષે એંશા ચૈત્યોને, પાંચ મેડુપર્વતને વિષે પાંચાશા ચૈત્યોને કરું વંદન કરું છું. ॥ ૨૪ ॥

ઉસુયારગિરિસુ ચહુરે, ચતાર્દ નમામિ ભણુચ્ચ સેલામિ ॥
નંદીસરામિ વીસાં, કુંડલ ડુઅગેસુ ચહુ ચહુરે ॥ ૨૫ ॥

શાખાર્થ:-

ધાતકીખંડ અને પુંકરાદ્ધી એ એને વિષે ચાર દક્ષુકારગિરિ છે તેને વિષે ચાર ચૈત્યોને તથા મનુષોંતરગિરિને વિષે ચાર ચૌલોને, તથા નંદીશ્વરદ્વારાપને વિષે વીશ ચૈત્યોને, તથા કુંડલગિરિને વિષે તથા ડયકદ્વારાપને વિષે ચાર ચાર ચૈત્યોને નમન કરું છું. ॥ ૨૫ ॥

એવં ગિરિદ્વુદ્ધસુ ગિરિ ખુદ તરસુ તરણ કુદેસુ ॥
દક્ષારાહિપણુસય, સાસય જિખુભવણ ભહિવલચ્ચે ॥ ૨૬ ॥

શાખાર્થ:-

એ પ્રકાર ગિરિના કુટને વિષે, ગિરિ, નદી અને ઉક્ષો નેં

વિષે તથા ઉદ્ઘોને શિખરને વિષે, પાંચગેતે અગ્નિયાર એવા ભૂમતલને
વિષે શાશ્વત એવા જિનભવનોને હું પ્રણામ કરું છું એ રીતે ૫૧
શાશ્વત જિનપ્રસાદ તિર્થદોકને વિષે થયા. ॥ ૨૬ ॥

આવતરિ લાખાહિય, કેડીસ-તેવ ભવણ ભવણેસુ ॥
જિલ્લાભવણેઉ અસંખે. વંતરનયરેસુ પણમાંબિ ॥ ૨૭ ॥

શાખાર્થ:—

ભવતપતિહેવના ભુવનોને વિષે અહેંતેર લાખે અધિક સાતકોડી
અર્થાત સાતકોડ અને અહેંતેર લાખ જિનભવનને, વળી વંતરહેવોના
નગરને વિષે અસંખ્ય એવા જિનભવનને હું પ્રણામ કરું છું ॥ ૨૭ ॥

વણુચેદિય સંખગુણે, જોડભિચેસુ તહા વિમાણેસુ ॥
તેવીસાહિય સહ્સા, સગનકૃઠ લાખ ચુલસીઈ ॥ ૨૮ ॥

શાખાર્થ:—

વંતરહેવતાઓના પ્રાસાદ છે તેથી અસંખ્ય ગુણા ને
જ્યોતિંકહેવોને વિષે જિનહેવનાં ભવનો છે તેને નમસ્કાર કરું છું.
તે પણી વળી સૌધર્માહિ હેવદોકને વિષે ચોરાશી લાખ અને તેવિશ
નેમાં અધિક છે એવા સત્તાણું હજાર અર્થાત ચોરાશી લાખ
સત્તાણું હજાર અને તેવીશ જિનભુવનોને હું વંદન કરું છું. ॥ ૨૮ ॥

સુરણાણેસુ સંખિં, સભપણું સહિ હોએ પહિમાણું ॥
ચેદ્યમજગફુસયં, ચેદ્યદારેસુ ધારસગં ॥ ૨૯ ॥

શાખાર્થ:—

સરી ચાર પ્રકારના હેવતાઓના સ્થાનકને વિષે પાંચ સભા-
ઓમાં પ્રતિમાતી સાઠ સંખ્યા છે, એકેક સભાપત્યે ત્રણ ત્રણ દ્વાર
છે, દ્વાર દ્વાર પ્રત્યે એક એક સ્ત્રી છે. તે સ્ત્રીને ચારે તરફ એક

એક પીડિકા છે, તે પીડિકા ઉપર ચાર દિશાઓમાં એક એક
પ્રતિમા સ્તુપને સામી છે. એમ એક સલા પ્રત્યે આર આર પ્રતિમા
થઈ. એ પ્રમાણે પાંચ સભાઓમાં સાડ પ્રતિમાઓ થઈ. તથા તેજ
ચૈત્યભવનની મધ્યમા એકસો ને આડ તેમ ચૈત્યના આરણૂમાં
આર આર પ્રતિમાં, એક એક પ્રાસાહને વણ વણ દ્વાર છે. કાર
દ્વાર પ્રત્યે એક એક સ્તુપ, સ્તુપને કરતી ચાર આજુ મહિંગાહિકા
છે, તે પીહિકાની ચાર દિશાઓમાં એકેક પ્રતિમા તે સ્તુપને જામે મુખે છે
તેને હું વંદન કરું છું. ॥ ૨૬ ॥

મલિયં સયં અસીયં, ચઉવીસસયં તુ નંહિસર દીવે ॥
પદ્ધયેધ્ય સેસેસુ, વીસસયં પડિમ તિરિલોઅં ॥ ૩૦ ॥

શાખાથ્ર્ય:—

એ સર્વે મહાને એકસોને ચેંશા પ્રતિમા તે દેવોના પ્રત્યેક
ચૈત્યમાં છે. વતી નંદીશ્વરદીપના ચૈત્યમાં એકસો ને ચોવીસ પ્રતિમા
અને શૈપ ચૈત્યોમાં તિર્યગદોકના પ્રતિચૈત્યની એકસો ને વીશ
પ્રતિમા છે. ત્યાં પાંચ સભા નથી. તથા નંદીશ્વરના પ્રાસાહેમાં ચાર
ચાર દ્વાર છે. તેથી ચાર પ્રતિમાઓ લાં અચિક છે, અને તિર્યગ-
દોકમાં શૈપ ચૈત્યની એકશો વીસ પ્રતિમાઓ છે તેને હું વંદન
કરું છું. ॥ ૩૦ ॥

અવણુવધ અવણેસુ, કાપાછવિમાણ તહુય અહિવલંઘે ॥
સાસયપડિમા પનરસ, કેઢીસય બિચત કેઢીઅં ॥ ૩૧ ॥

પણપનલાખપણવી, સ સહસ પંચયસયાઉચાલીસા ॥
તહુ વણળોદસુરેસુ. સાસય પડિમા પુણ અસંખા ॥ ૩૨ ॥

શાખાથ્ર્ય:—

અવતપતિના સર્વે અવનોમાં, તથા આર દેવદોક, તવ એવેયદ

શાશ્વતી પ્રતિમાની સંખ્યા કરતાં અતરથો કરોડ, અહેંતાલીશ કરે હ, પંચાવત વાખ, પંચાલીશ હળર, પાંચથો અને ચાલીશ પ્રતિમાઓ છે, તથા વગી વંતર અને જ્યોતિષ દેવતાઓમાં શાશ્વત પ્રતિમાઓ અસંખ્ય છે, પ્રથમ પ્રતિમાની સંખ્યા છે તે વંતર અને જ્યોતિષ દેવતા વિમાનો વજિને જણુંની. ॥ ૩૧ ॥ ૩૨ ॥

ઉસમા ચંદાખુણુ વ-દ્વારાન તહુદસિદ્ધિ વારિસેખુણ્ય ॥

સંવા સાસયપડિમા, પુણુપુણુરવિ એય અડી નામા ॥ ૩૩ ॥

શાશ્વતાર્થ:-

૧ ઇપભાનન ૨ ચંદાનન ૩ વર્દ્ધમાન તેમજ ૪ શ્રી વારિસેખુ ભગવાન સર્વે શાશ્વતી પ્રતિમાઓ, જે છે તેના વક્તી વલી એક ચૌત્યથી બીજી ચૌત્ય પ્રત્યે પણ ચાર નામ જાણુંના. ॥ ૩૩ ॥

જાણુ ધાયનુ પુસ્કર, દીવે વિજયાખુ સતરિસયાભિ ॥

અવિએ લુચિ ઓહંતે વિહુરંતે જુગવમરિહુંતે ॥ ૩૪ ॥

શાશ્વતાર્થ:-

જાણુદ્વાપમાં, વાતકીઅંદ્રીપમાં, પુંકરવરદીપાઠ્રમાં વિજયોનું એકથો ને સિટેર વિજયોના મધ્યમાં સમકાલે પૃથ્વી ઉપર અવોને એધ કરતા થકા વિચરતા એવા શ્રી હીનંત ભગવાનને ॥ ૩૪ ॥

નમિમો ઉક્ષોમપએ, સતરિસયં તહુ જહુનનાઓ વીસં ॥

કણુગકલહેણ્ય વિદૃદ્ધમ, ભરગયવર રિકુરયણુનિસે ॥ ૩૫ ॥

શાશ્વતાર્થ:-

તે ઉક્ષુતપદે શ્રી અનેતા જિનને વારે તો એકથો ને સિટેર જિનને,

તथा જગન્યાંથી વીશ તિર્થાંકર નેમને નમાયે છીએ. તે જિનેશ્વરો
કેવા છે? તો કે સુરાણી અને રંપું તથા પ્રવાલું, મરુકનમણિ,
નીરમણિ, પિંડિત, સ્વામણિ તેના સરણીઓ કે કાંતિ જેમના શરીરના
ઓસા છે. ॥ ૩૫ ॥

જાંબુહીવે ધાયદ, સંઉ તહુ ચેવ પુંખરંધ્ય ॥
સીમંધર જુગમંધર, આંદુ સુભાંડુ સુજાયો અ ॥૩૬॥

શાલાંથ્રી:-

જાંબુહીપને વિંં, વાતકાખાંડને વિંં, નેમજ વળી પુંકરાંદ્રને
ઘિંં, વર્તમાનકાવમાં વિચરતા વીશ તિર્થાંકરેના નામ કહે છે.
૧ શ્રી સિમંદર, તથા ૨ યુગમંધર, ૩ આંદુજિત, ૪ શ્રી સુભાંડુ-
જિત, વળી ૫ શ્રી સુજન. ॥ ૩૬ ॥

છડા સયાંપહુપહુ, ઉસલાણુણુ તહુ અણાંતવિરિયો અ ॥
બુધ્યણુ વિસાણો, વજાંધરો તહુ કર્ણાર સમો ॥૩૭॥

શાલાંથ્રી:-

છડા સયાંપહુપહુ, ૭ ડાંબાનન, તથા ૮ અનાંતરી,
૯ શ્રી સુરપ્રભ, ૧૦ શ્રી વિશાવજિત તથા અગ્રારમ શ્રી વજાંધર ॥૩૮॥

ચાંદાણુણુ સિરિયાંદ, આંદુહેવો ખુજાંગ ઈસરયો ॥
નેમિપહુ વીરસેણો, મહાલહો હેવજસ સામિ ॥૩૯॥

શાલાંથ્રી:-

૧૨ શ્રી ચંદ્રાનન, ૧૩ શ્રી ચંદ્રાઙ્ગદેવ, ૧૪ શ્રી ભુજાંગદેવ,
૧૫ શ્રી ધન્યર, ૧૬ શ્રી નેમિપ્રભ, ૧૭ શ્રી રસેત, ૧૮ શ્રી મલાંદાદ,
૧૯ શ્રી હેવયશા સ્વામી. ॥ ૩૮ ॥

સિદ્ધિઅજિય વીદિયજિણુા, દ્વય અચ્ચે સંપયં વિહુરમાણુ ॥
વહે વીસ જિણું હે, તિહુઅણુ વહે સુકયંદે ॥૩૭॥

શાન્દાર્થ:-

૨૦ શા અગ્રિતરીર્થિનત, એ કહ્યા એવા લાવમાં મદાવીદ્વિદ્વ-
દ્વારમાં વિચરતા એવા નીંઠે જિનને હું વંહન કરું છું. તે કેવા છે ?
તો કે, વળે ભુવનતા શ્વોને વંહન કરવા યોગ્ય અને સુકૃતાં ભુવ
એવા શ્રી અરિદંતો છે. ॥ ૩૬ ॥

શુયતીઅ અણુવગ વહુમાણુયા સાસયા ચ વિહુરંતા ॥
શુખિયા જિણિંદ્વાંદા, પ્રયપંક્યપણુયમાહિંદા ॥૪૦॥

શાન્દાર્થ:-

જે પ્રવે અતીતકાલે થઈ ગયા અને હવે થવાના છે તે નથા
વર્તમાન ચોલીશીના અને શાન્દાર્થતા એવા અને વલી વિચરતા એવા
જિન વિષે ચંદ્રમા સમાન એવા જિતોશ્વરને મેં સ્તવા. હવે તે
કેવા જિનચંદ્ર છે ? તો કે જેના ચરણુકમણને ચુરેંદ્ર નન્યા છે. ॥૪૦॥

અણાવયમુજજુંતે, ગયઅગ્ગપચે ચ ધૂમચ્ચકે ચ ॥
પાસરહુયાતણુયં, ચમડુચ્ચપાયં ચ વંહામિ ॥૪૧॥

શાન્દાર્થ:-

પ્રથમ આટાપદીર્થિને, ખીજન ગિરનારને, ત્રીજન ગનનાપહેને
વળી ચોથા ધર્મચક્ષને, પાંચમાં પાંચરીથી તેને, છ્ડા રથાવર્તન
નીર્થિને. સાતમાં ચમશેત્પાત તીર્થિને હું વંહન કરું છું. ॥ ૪૧ ॥

અણુપય ગિરિરાચે, પણમેમિ શુંબામિ તહુય જજાઓમિ ॥
ધૂમધૂર ધરણુયસલં, ઉસલં પણમંતમુરવસલ ॥૪૨॥

શાલ્હાર્થ:-

આદ્યાપત્રગિરિરાજને વિષે શ્રી દ્વારાદેવને હું નમનકાસ કરું છું,
તथા સુનું કરું છું. તથા ભાગ કરું છું, તે સંબલ નિર્ધારિત કરે કેવા
છે ? તો કે ધર્મરૂપ રચના ભરતે વહન કરવામાં વ્યાપક સરખા છે.
વરી કેવા છે ? તો કે, પ્રણામ કરે છે ઈર્દી જેમને એવા છે. ॥૪૨॥

અજિઅધિષ્ઠણો વીસેસે, વર અદ્ય સેસે જિષ્ટું તેવીસાં ॥
તણ સાસય ચણેનામા, સોલસપદિમાઉ થુલેમુ ॥૪૩॥

શાલ્હાર્થ:-

વળી મનોદુતમદિમાયે કરી પ્રસિદ્ધ એવા આદ્યાપત્ર ઉપર
આકી રહ્યા એવા અજિત નીર્થ કરે છે આહિ જેમાં એવા પણ
પ્રનેશ જિતેને તથા શાશ્વતધ્રાકૃત ચાર જેનાં નામ છે એવી સોચ
પ્રતિમાઓ રહુંનાને વિષે છે તેને હું પ્રણામ કરું છું. ॥ ૪૩ ॥

ઉસમસ્સ સમોસરણા, પયાપંક્ય અંકણા ઉસ્સિયગમણા ॥
તદ્વલદિધરેાહુગ સિદ્ધી, ઉગ્માયે અડાવયામિ થુણે ઉસલાં ॥૪૪॥

શાલ્હાર્થ:-

જેમને એવા મુનિયો અને કેશવાયેક તિળાં સમવગરણુમાં
મુક્તિ પાંચ્યા છે, તેઓની પણ પ્રતિમાઓ ભરતે ત્યાં સ્થાપી છે,
તથા તપુરુપક્ષાયિધ્યે કરીને પ્રાપ્ત થનું છે આકાશોત્પન્ત ડ્રગિધ્ય
જેને એવા મુનિયોને હું જણું છું અને તે દ્વારાદેવને નમું છું.
॥૪૫॥

મુર અમુર ખયર નરચર, સુરિંહ વંદિજામણ જિષ્ણુલઘણ ॥
અકુલયગિરિતિથાં નંકઉ જાવીરજિષ્ણ નિશ્ચથા ॥૪૫॥

શાસ્ત્રાર્થ:-

સુર અને અસુર, વિદ્વાર, નરવિપો એવાં તથા સુરેંદ્ર તેમણે વંદ્ન કર્યું છે. જિતભરત જેને વિપો એવું આધ્યાત્મરત તીર્થ છે તે જ્યાં સુરી વીર ભગવાનનું તીર્થ ચાકે છે ત્યાં પર્વત વિજયરંગ થાઓ ॥૪૫॥

જયવહૃતસિરિતિલાંઓ, નેમી વયગહુણુ નાણુ નિવ્યાણે ॥
જહિં પતો સો નંદા, ઉજાતો તિગુણમિહુ નિશ્ચં ॥૪૬॥

શાસ્ત્રાર્થ:-

જેને વિપો નેમિશ્વર ભગવાન વત ઘેણુણ, કેવલજ્ઞાન અને નિર્વાણને પામી ગયા છે. હવે તે નેમિશ્વર ભગવાન કેવા છે? તો કે યાદ્વાદુદ્વારની લક્ષ્મીના શોભાયમાન તિલક અમાન એવા છે. હવે તે ઉજાત પર્વત જયવંતો થાઓ. તે પર્વત કેવો છે? તો કે જે આ ભરતમૈને વિપો શ્રી નેમિશ્વર ભગવાનના વણુ કદ્યાખિકરણ વણુ ગુણુમય તીર્થ છે. ॥૪૬॥

તં રેવતિગિરિ સિહુર, તિલોયસારં તિલોય જર્ણુ મહિયં ॥
ગણે તિલોય નિલાં, નિલોય પહુનેમિ જહિં પતો ॥૪૭॥

શાસ્ત્રાર્થ:-

તે પ્રસિદ્ધ એવું રેવતિગિરિશિખરનામા તીર્થ વણુ લોકમાં સારભૂત છે. તથા વણુ લોકનીવાસી જનોએ પૂજન કર્યું છે કે જે પર્વતને વિપો વણુ લોકના પ્રભુ એવા નેમિશ્વર ભગવાન વણુ લોકના તિવક્રિય એવા મોક્ષ સ્થાન પ્રયે પ્રાપ્ત થયા. ॥૪૭॥

રેવતિગિરિમિ ભવજલ-હુ પોયભુયાંમિ નેમિનિજાંમો ॥
હલ્લિયં હુક્કિયવગાં, સાશં પરગાં લડું તેર્થ ॥૪૮॥

શાસ્ત્રધાર્થ:-

સંસારનમુદ્રને વિંચ વદાણું સમાન એવા દેવતાચલને વિંચ નોમાંશર ભગવાન નિર્યામણ સમાન છે, તે હૃદિઃખિત એવા નિર્ધિન હૃદાચલસ્થાં પામેલા જનતા વર્ગને લખું શાશ્વતાથી સ્વર્ગ અને મોક્ષ ને પ્રત્યે પમાડે છે. ॥૪૮॥

એસે દસનનકુટે દસનલભહસ્સુ ગંગબહુરણુહુ ॥
સકકો હેવાહિન્દુ, નિયદુ હીં દસએ એવા ॥૪૯॥

શાસ્ત્રધાર્થ:-

દ્વારણુકૃટ નામા પર્વતને વિંચ દ્વારણુભક્તના ગર્વ હરણુ કરવાને માટે દેવતાનો અધિપતિ એવો ઘન્દ, તે પોતાના રીદીને આ પ્રમાણે હેખાડે છે. ॥૪૯॥

ચઉસઠિ કરિસહરસા, સઠવે ચઉસઠિ અઠ મુહુજ્ઞ-તા ॥
અઠ મુહુજ્ઞ-તા અડઉ, પદ્ધતાં અડ વાવીએ ॥૫૦॥

શાસ્ત્રધાર્થ:-

ચોસઠ હળર હાથી, તે સર્ને ચોસઠ આહગણુા કરીયે નેટલા અર્થાત પ્રત્યેક લાથીને પાંચશે ને આર મુખ છે અને તે લાથીઓ ના વત્યેક મુખ પ્રત્યે આડ આડ હાંતો છે અને પ્રત્યેક હાંતે આડ આડ વાચિકાએ છે. ॥૫૦॥

પદ્ધવાવિ અડકમલા, પદ કમલાં લાખ્ય-ત પદવ-તા ॥
અ-તસવિંહું નાડયા, પદકણીય વરયણુપાસાએ ॥૫૧॥

શાસ્ત્રધાર્થ:-

નથા પ્રત્યેક વાન્ય પ્રન્ય આડ આડ કમલો છે અને પ્રત્યેક

કમદમાં લાખ લાખ પત્ર છે, તથા પ્રત્યેક પત્રમાં અતીશ પ્રકારનું
નાટક થાય છે; અને તે પ્રત્યેક કમદના પ્રત્યેક કણ્ઠીની પ્રત્યે એક
એક રતનો પ્રાસાદ છે. ॥૫૮॥

પદ્ધ પાસાથાં અડું, ભાદાસણુયાંદ રયણુચિન્તાં ॥
સીહાસણુમેગેજાં, સાયાયરીંદ રયણુમયચિન્તાં ॥૫૯॥

શાલાથ્રો:—

પ્રત્યેક પ્રાસાદમાં રતને કરી ચિત્રવિચિત્ર એવા ભદ્રાસનો
આં આં છે. તથા રતનમશનણું એ ચિત્રવિચિત્ર એવું અને
પાદરીંદ સહિત એવું એક એક સિંહાશન છે. ॥૫૯॥

પદ્ધ સિહાસણુનિંહો, પદ્ધભાદાસણું મણમહિસીએ ॥
દ્વયતિપ્યાળુણ પુંબં, ગયઅગ્ગાપ્યાણું ભુવિ હોવિ ॥૫૩॥

પડિણંભયતો સક્કો, વંદ્ર વીરં તચો દસણુલહો ॥
વિહિ અમણુસો હુરિ ચૈન્યણુણ વિલઉય પંબાદચો ॥૫૪॥

શાલાથ્રો:—

એકદિક શિંહાસન પ્રત્યે છન્દ્ર દૈક્ષિયડ્ય ધારણું કરીને એકેદો
છે. તથા એકેક ભદ્રાસન પ્રત્યે એક એક અચમલિંધી છે. એ પ્રકારે
કરીબને હેખાડતો એવો સૌધમેંદ્ર તે પ્રથમ નણું પ્રહળિણા. કરીને
તે પૂર્વોક્તન હસ્તીના આગલા એ પગ પ્રત્યે દશાણુંકટ પર્વતની
શિખર ભૂમિને વિષે પ્રતિલિંઘ પાડતો થકો શા વીર ભગવાનને
સૌધમેંદ્ર નમસ્કાર કર્યો. છન્દ્રનું એશવર્ય હેખીને પણી દર્શાણું—
ભદ્રરાજ વિદિમત છે મન જેમનું એવો છો લજન પામાને
છન્દ્રની પ્રેરણુંથી ચારિત લેતો હવો. ॥૫૩॥ ॥૫૪॥

ગયાં ગગપણો એવાં, જાણો તહીં શુશુદ્ધ વીજ જિણાં ॥૫૫॥
શાસ્ત્રાર્થઃ—

તે ખણી છંડ હર્ષાણુભવમુનિના ચરણુને વિણે સ્વહૃત અપરાધને
ખમાત્રાને તે મુનિતી પ્રશંશા કરીને સ્વર્ગ પ્રત્યે ગયો. એ પ્રકારે
તે પર્વત ગગનઘન નામા તીર્થદ્વય થયો. મારે હે જનો ! તર્દાં
તે ગગનઘન તીર્થને વિષે વીર લગ્નાનને સત્ત્વો. એતો વિસ્તાર
એ તીર્થની કથા નથા હર્ષાણુભવ મુનીની કથાશી સમજવો. ॥૫૫॥

તાખસિલાંએ ઉસભો, વિધાલિ આગમ પહિમહિજણે ॥
જ આડુઅકી પસાએ, એટ તા વિહુરિએ ભયવં ॥૫૬॥
શાસ્ત્રાર્થઃ—

તદ્વાણિલા નામા નગરીને વિણે સાયંકાલે શ્રી રૂપભેવપ્રલુ
આનિને વનને સિંહે કાઉસગગપણે રહેતા હવા, એ વાત સાંભળાને
જેવામાં આડુઅકી રાજ પ્રભાતને વિષે વંદન કરવા આવે છે,
નેટ્વામાં આદિશર લગ્નાન વિહાર કરી ગયા. ॥૫૬॥

તો તહીયં સો કારણ, જિણુપથાણં ભિસ્યણુમયાદીઠં ॥
નહુવરિ જેયણુમાણં, ભિણુરથણુનિણુભિમયં દંડં ॥૫૭॥

શાસ્ત્રાર્થઃ—

તહનંતર તે આડુઅકી રાજે, તે સ્થળો જિતના પગના
સ્થાનકને દિયે રત્નમય પીડને કરાયું છે. અને તે પીડના ઉપર
એક યોજના પ્રમાણે મણિ અને રત્ને નિર્માણ કરેલ સો હંડને
કરાયું છે. ॥૫૭॥

परस्परावरि रथणुभयं, ज्ञेयणुपरिमंडलं पवनवक्तुं ॥
तं धर्मभयकुक्त निश्चयं, अवश्यलनिहि पवर षाहित्यं ॥५८॥

शास्त्रार्थः—

ते दंडनी उपर रत्नभय योजना प्रमाणु आह्य भरिधिमंडल
अेवुं उत्कृष्ट वह कराव्युं छ. ते संसार समुद्र तरवानेह उन्म
वहाणु समान अेवुं धर्मवक्तिर्थ छ. ए नीर्थनीलविमुक्त
आहुअवीना वरित्रथी समग्र लेवा. ॥५८॥

सिवनयरि कुसङ्गवणे, पासो अडिभं ठिए अ धरणिहो ॥
उवरि तिस्तां छनां, धरिसु इसीय वरभलिभं ॥५९॥

शास्त्रार्थः—

शिवनगरने विषे कुशावृतनभां श्री पार्थ्वनाथ डोरेत्सर्गने
विषे रखावली तेना अवधितानथी जाणीने धरणुंद्र पातोलवी
आवीने उपर त्रणु रात्रि वर्णत अनेधारणु करी अने, नारुय
आहिभ मोटा भालिमा करतो हवो. ॥५९॥

तं हेउ सा नयरी, अहिष्ठ-ता नामयो जणु जय ॥
तलियं नभिमो पासं, किधविलासं गुणावासं ॥६०॥

शास्त्रार्थः—

ते कारणु भाटे ते नगरी नामे डी अहिष्ठना लोकते विषे
प्रसिद्ध थध ते स्थवने विषे श्री पार्थ्वनाथने अमो नमन करीजे
छाये ते पार्थ्वनाथ डेवा छे ? विघ्नने नाश करनार अवा अते
गुणेना आवासउप छ. ते नगरीनुं नाम अहिष्ठना केम, पडयुं
जया धरणुंद्र आवी श्री पार्थ्वनाथ उपर अव धारणु क्युं नेथा
ते नगरीनुं नाम अहिष्ठना पडयुं. ॥६०॥

પડિમાણે ડિયાં પાસાં, કમડો હરિકરિપિસાયપભુહે હિં ॥
ઉવસળિગાય -તો વરિસહ. આમંડજીગમુસલધારાહિં ॥૬૨॥

શાખાથ્રી:-

કારોંતસર્ગને નિષે રહેલા એવા શ્રી પાર્વતિનાથને કમદ નામને
દ્વારા, સિંહ, લાથી પીશાચ પ્રમુખના રૂપોએ ઉપસર્ગ કરીને તે
પછી અખંડિત એવા એવડા મુશ્વા સમાન જવાનારાંં કરી શ્રી
પાર્વતિનાથ ઉપર વરસાવતો હવોા, ॥૬૨॥

ઉદગાં જિણુનાગાં, પ-તા તો લદુ કરેદ ધરણુ હોા ॥
જિણુઓવરિ કણુાછ-તા, બોગેણુથ હેઠાહિ પરિહિ ॥૬૩॥

શાખાથ્રી:-

તે જલ, શ્રી પાર્વતિનાથને નાસિકાના અચ્યપર્યાત આસે થયું
તે પછી અવધિજાનથી જણુને ધરણુંદ્ર રાચ આવીને શ્રી
પાર્વતિનાથ જિતની ઉપર ઇણુાંપ જવાં કરે છે, વલી પોતાનાં
શરીરે કરીને તે ધરણુંદ્ર પ્રભુના હેઠાહું આણેદ પરિચિ ગેઠલે
વેણુને કરે છે. ॥૬૩॥

ચરણુાહો યુદ્ધનાલાં, કમલાં તો કમડુ આમિંડં નડો ॥
ધરણુંદ્ર ગાંઘો સવાસાં, જિયઉવસંગાં નમહ પાસાં ॥૬૪॥

શાખાથ્રી:-

પ્રભુના ચરણુની નીંબ મોડું છે નાચ જંજું એવું કમલ કરે
છ., તે પછી અવધિજાને કરી અગ્નાનનું સ્વર્પ જણુને તર્ફના
ધાર્યો એવો કમદનામા હેવતા પ્રભુને અમાત્રાને નાંડા. અને ધરણુંદ્ર
નાગ, તે પોતાના સ્થાનક પ્રલે ગયો? માટે કૃત્યાં છે ઉપસર્ગો
જેણું એવા શ્રી પાર્વતિનાથનાં હું ભવ્ય હવો! રમે નમન કરો.
॥૬૪॥

સિરિ વયરસામિ પદમા, રહિએ સેલામિ તેસિ ખુદેણુ ॥
પદમં ક્ષ્યમારાહણુ, લોગપાલા નચો ચક્કરો ॥૬૪॥

શાસ્ત્રાર્થ:-

શ્રી સજસ્વામીએ પ્રથમ આરાધણુ કરેલા પર્વતને વિષે તે વજસ્વામીના કુલક એવા શિષ્યે પ્રથમ આરાધન કર્યું. ત્યાર પછી ચાર લોકપાદો ॥૬૪॥

રહુદાપાયાહિણુ, કરું ભહિમં કરિસુ ખુડરસ ॥
તં હેઉં તયં તિથં. રહુ આવતં તિતં નમિમો ॥૬૬॥

શાસ્ત્રાર્થ:-

રથમાં એડા છતાં તે ચાર લોકપાદો પ્રદક્ષિણાને કરીન કુલક શિષ્યના મહિમાને કરતા હવા. તે કારણુ માટે રથાવર્તનામા તીર્થ, એ પ્રકારે જગતમાં તે નામથી વિશ્વાર પામ્યું. તે તિર્થને સુતિકાર કહે છે, અમે નમન કરીએ શીએ. ॥૬૫॥

સિ.રિનયર સામિ રાહણુ, ગિરિમિ સક્કો રહેણુ અહુ કરિણુ ॥
ધાયાહિણુ તા સોવિય, રહુાવતો કુંજરાવતો ॥૬૭॥

શાસ્ત્રાર્થ:-

શ્રી વજસ્વામીને આરાધન કરવાના ગિરિને વિષે સૌધર્મેન્દ્ર રથે કરીને પછી હસ્તીએ કરી પ્રદક્ષિણાને કરતો હવો. તે કારણ માટે તે પર્વત પણ રથાવર્તને એવે નામે વહી બીજું કુંજરાવત્ને એવે નામે તીર્થ થયું ॥૬૬॥

જાથય વગજપલાણુ, ચમદે વીરપથંતરે નિષુક્કો ॥
હરિણુ મુક્કો ન-તો, ગિરણપુરચો હસચે નહું ॥૬૭॥

શાસ્ત્રધર્મઃ—

વહી ને સ્થળને વિષે વહે થકો પદ્ધતિન થયો એવો અમેરો અસુર, શ્રી વીર અગ્રવાનના અરણુના અંતરાલને વિષે રૂપાવી પડ્યો. પછી તે સ્થળ થકો હન્દે છોડી મુક્યો. જો શ્રી વર્ધમાનસ્વમીની આગળ નાટકને હેઠાડો હતો, ॥૩૭॥

તો કેહિ તિથથં જાય, અમરૈપાયં ચ સુસુમાર પુરે ॥
સોમવણે તહિં વીરં, નિહુયણુ જણુવરણલં નમિમો ॥૩૮॥

શાસ્ત્રધર્મઃ—

તે પછી તે સુસુમારપુરના સોમવનને વિષે અમરોત્પાત નામે તિર્થ પ્રાચીદ થયું. માટે તે સ્થળને વિષે નણ લુચન નિવાસી લોકને પ્રિય એવા શ્રી વીર અગ્રવાનને અમે નમસ્કાર કરીએ શીং. ॥૩૯॥

શુય બાહુવિહ અચ્છેરય—નિહીસુ અફુયયાઈ ઠાણેસુ ॥
પણુમહુ જિખુયર અહે, સુલનભરનભરમાહિહે ॥૩૯॥

શાસ્ત્રધર્મઃ—

એ શીતે ઘણે પ્રકારે આશ્રમના નિર્ધિયો એવા આપુફન નિર્થ જેમા મુખ્ય છે એવા સ્થાનકેને વિષે રૂપી અદિતના ભાડે કરી નન્યા છે છાંડો જેને એવા નિતનર ચંદ્રોને હું લોઢા ! તમો નમત કરો. ॥૪૦॥

માસં પાચોવગયા, વંધારિયપાણિષ્ઠો જિખુા વીસં ॥
સિદ્ધિં ગયા જાથં તથં, નમિમો સમેયગિરિ સિહુરં ॥૪૦॥

માસપર્યાંત પાચોગમત આસને રહ્યા થકો અનરાનને કરતા એવા એને કાર્યોત્ત્સર્વમાં કાંચા કર્યા છે. કાથ નેમણે એવા

ઓખદૈન, વાસુપૂજય. ॥૧૮॥ વાર અને નેમા એ ચાર જિત વજિને શોધ
નારા જિનો ને સ્થળને વિષે સિદ્ધને પ્રાપ્ત થયો ને સમેત ગિરિ
શિખરને નમન કરીએ છીએ. ॥૧૯॥

જ સમેયે સંધા, અજિય જિણુંદા પરંપિ આયંસુ ॥
તેણું થ સો ભહુતિથથં, તિલોયજણું નારણુસમત્થં ॥૨૦॥

શાલાર્થ:—

જે કારણ માટે ઓ અનિતનિતોંડ થક્કા પૂર્વે પણ સમેત
શિખરને વિષે સંધા યાતાને માટે આવતા હતા. તે કારણ માટે
આહિં વિશ્વને વિષે તે સમેતશિખરગિરિ મોહું તિર્થ થયું છે, તે
કેવું તિર્થ છે? નણે લોકના જીવને તારતાને સમર્થ છે. એ
તિર્થનું મહાત્મ્ય વિસ્તારથી સમર્દ્દીના પુત્રોના પાછલા ભવના
ચરિત્રથી સમજ કેવું ॥૨૧॥

જત્થય પડમં સિંધાં, પુંડરિએ ણુગમુણિ સહુસુસ જુએા ॥
તકકાલા જા જંણુ, અસંખ કેડીએ તા સિંધ ાજરા ॥

શાલાર્થ:—

વલી ને પર્વતને વિષે પ્રથમ અનેક મુનિના સહનોએ યુક્ત
એવો પુંડરીક ગણધર સિદ્ધીને પ્રાપ્ત થયો છે, તે કાલથી આરં-
ભાને ન્યાં પર્વત ચરમ કેવલી એ જાણુરસ્વામી સિદ્ધ થયા ત્યાં
પર્વત અશાંખ્ય કારિ જીવ સિંધ થયા. ॥૨૨॥

જત્થ થ સિંધા પંડવ, પજજુનન સંબાડ જાયવા ભહુવે ॥
તં વિમલ વિમલગિરિં, શુણિમો અદ્વિમલપયહેઉં ॥૨૩॥

જે પર્વતથ વિષે પાંચ પાંડવ, પ્રદ્યુમન અને સાંખ નેમા
આહિ છ. એવા વણું યાદો સિધ્ધીને ખાન્યા. તે અતિ નિર્મલ

એવા મોક્ષપત્રનું સાધન છે. જેમાં એવા નિર્મલ, ને પ્રચિદ્ધ
જિમલાયલને સત્તીયે કીએ. ॥૭૩॥

જાથ ય નેમિં સુન્તું, નુણાં ઉસસાદણા જિણુા રહિયા ॥
કહુમન્નહુ તેવીસાં. જિણુપથજીયલામ પડિયિંથા ॥૭૪॥

૧૧૦૫થી:-

કચિ વિતાઈ કરે છે કે નેમીશ્વર લગવાનને સૂક્ષ્ણાને જે પર્વત
ને વિષે કહુભહેવજુ વિંગેરે ત્રૈનિશ જિન આઉદ્યા અર્થાત ચુદ્ધા
એમ ત્રૈનિશ જિન સમવસર્યા ન હોગ તો તે ત્રૈનિશ એવા જિન
તેના પદ્ધુગલોનાં પ્રાન્તિયિંએ કેમ હેખાય છે? અર્થાત જે ત્રૈનિશ
તિર્થ કરે. તે સિધ્યાયક પર્વતમાં સમવસર્યા ન હોય તો તે
ત્રૈનિશ જિનતા પદ્ધુગલનાં પ્રતિબિંંખ કરાંથી હેખાય? ॥૭૪॥

જહિયાં સિરિસે-તુજે સુરનરપુજાજે અણુંગવદ ચુબજે ॥
પણુમહુ જિણુનર વસલાં, વસલાંકું વસતીસુમિણુંચ ॥૭૫॥

૧૧૦૬થી:-

ને શ્રી શત્રુંજ્ય પર્વતને વિષે જિનોને વિષે ક્રેદ એવા શ્રી
શત્રુંજ્યને હે જનો! તમે પ્રણામ કરો. કદે તે શત્રુંજ્ય પર્વત
કેવા છે? દેવતા અને મનુષ્યોએ પુનર કરવા યોગ્ય અને વિવિધા-
અર્વામય છે. તે શત્રુંજ્ય પ્રભુ કેવા છે? અલદનું ચિહ્ન જેને એવા
ગર્ભમાં આવતી વખત માતાએ ચઉદ્દ રૂપમાં પ્રથમ ગૃહનું
નવન દીદું મારે શત્રુંજ્યન નામ પાડ્યું. ॥૭૫॥

તત્યાનિયાણુનાચે, સેય પડાગા નિસાઈ જહિં જયા ॥
અવગપભાવા તં ધુણિ, માડુરાઈ સુપાસ જિણુંકુજું ॥૭૬॥

શાન્દારથી:-

હુ ખુધજને! મયુરાળને વિંસ સુપાર્વનિતસુભને રહુંની
કરો. જે સુલ રાત્રાએ બૌધ્ય દર્શનીયોના વાદને વિંસ માસકૃપ-
ણુદિ ઉચ્ચ તપકારી ક્ષપક નામના ઢીપીના પ્રભાવથી ધ્વજ સમેત
અછ તેને સર્વજીવન સ્તવો. ॥૧૬॥

ભડ્યાચંદ્ર કોરંણ, સુષ્વય જિયસ-તુ તુરગ જાણસરો ॥
આણુસણુ સુર આગાંતુ, જિણુ મહિમ મદાસિ નો તહિંથ ॥૧૭॥

શાન્દારથી:-

ભર્ય નગરને વિંસ કુરંટક. ઉધાનમાં મુનિ સુવતસવામીને
નિતશન રાજ અને પોતાના ખૂર્વજીવનું રમરણ થયું છે જેને
એવો તુરગ એ એ જણુ વંદન કરતા હવા અને તે તુરગ અનશન
ગ્રત કરીને હેવ થયો. તદનંતર તે હેંકણે તે હેવ આવીને શ્રી નિતિન
ભગવાનના મહિમાને કરવા લાગ્યો. ॥૧૮॥

અહસાવાણુ નિથયં, જાયં નં નામ પુણુવિ ભીયમિલં ॥
સિદ્ધિસમલિયા વિહારો, સિંહલધ્ય કારિ ઉધ્યારો ॥૧૯॥

શાન્દારથી:-

ને અશ્વારાંધ્ર નામનું તીર્થ થયું. ત્યાં નિતશનું શાન્દારથે
પ્રાસાદ કરવાને શ્રી મુનિસુવતસવામીનાં છવતાંજ તેમની પ્રતિમા
સ્થાપના કરી. તથા તેજ તીર્થનું ફરીને પણ પીજું નામ થયું.
ને કર્વા રીતે? સિંહલરાજની દીકરીએ કર્યો છે. ઉદ્ઘાર જેનો
એવું ને તે તીર્થ નેનું શ્રી શામલિકવિહાર નામ થયું. ॥૨૦॥

જિયસ-તુ આસ સમલી, પાસ સુપાસા સુહંસણાહેવી ॥
નિયનિય મનિહિં અજજવિ, સેવતે સુષ્વય તહિયં ॥૨૧॥

૧૭૮૬થી:-

જિતશરૂ રાગ અને પૂર્વોક્ત અથ, શામલી અને નેની
પાદ્યનામની જખી તથા આજ સુખાંનામની સખી, સુહર્ષના
નામની દેવી, એ સર્વે પોતેપોતાની મૂર્તિએ કૃતીને હજુ સુખ
પણ તે સ્થળને વિન મુનિસુવતસ્વામીને સેવન કરે છે. ॥૭૬॥

છક્કાર્યાખ ચુલસી, સહસ્ર કિંચુણુ વરિસ જીસ્સ તહિં ॥
જીવંત સામિ તિથે, ભડુઅંછે સુંબ્યય નમિમો ॥૮૦॥

૧૭૮૭થી:-

અગીયાર લાખ અને ચોરાશા હળવાશ્કીં કાંદ્ધક ઉલ્લાં
એવા વર્ષોનું તિર્થને થયાં એટલે આ તીર્થમાંથી રતોત્તરહુયું
તે દ્વિસથી, તીર્થને પૂર્વોક્ત સંઘચાંકવરસ અયાં માટે તે સ્થળને
વિષે ભડુયમાં જીવંતસ્વામિ તિર્થને નિષે સુખસ્વામીને નમન
કરીએ છીએ. આ ભડુય તીર્થનું માણાત્મ્ય સુહર્ષનતા ચરિત્રથી
નાણી લેવું. ॥૮૦॥

સન્તિહિય પાડિછેર, આસ વંદામિ ધંભણુપુરંમિ ॥
પાવયગિરિવરસિહુરે, દુહદવનીર થુણે વીર ॥૮૧॥

૧૭૮૮થી:-

સંભનપુરને વિષે શ્રી પાદ્યનાથને હું વર્દન કરું છું. તે
પાદ્યનાથ અયવાન કરા છે? પ્રાનિદ્યાર્થ કે મહિમાને છે સાનીન
દિલ કરેને એવા છે. વર્તી ક્રીએ એવા પાવકગિરિના શિખરને વિંસ
જરૂર, જરૂર અને મરણાદિક દુઃખ દાવાનથ નેને શમાવવાને જરૂર
સમાન એવા શ્રી વીર અગ્રવાનને હું અનું છું. ॥૮૧॥

કન્ન ઉજાનિવનિવેસિય, વરજિણ અવણુંમિ પાડલાગામે ॥
આધચિરમુત્તિં નેમિં, ખુણિ તહુ સાંખેસરે પાસં ॥ ૮૨ ॥

શાસ્ત્રાર્થ:-

પાડલા નામને વિષે કાન્યકુઙ્ગ રાગએ કરવેલા શ્રીઃ
એવા જિન પ્રાસાદને વિષે અત્યાંત બણું કાદ્વાની છે મૂર્તિ જેની
એવા નેમીશ્વર અવાનને હું સ્તવું છું. તથા શ્રી કાંભેશ્વર નામને
વિષે શ્રી પાર્શ્વનાથને હું સ્તવું છું. ॥૮૨॥

પારકરહેસમંડણ-ખુચ્ચે ગુડરગિરિંમિ ઉસલ જિણો ॥
નંડિ તિલોયતિલએ, અવલોયણ મિતાંતરક્લો ॥ ૮૩ ॥

શાસ્ત્રાર્થ:-

પારકર હેસના મંડનભૂત એવા ગુડરનામા ગિરિને વિષે તથ
દોકને વિષે તિલકરૂપ એવા અને અવલોકન માત્ર કરવા થકી દીપું
છે. સાંત્રાન્યરૂપ ઇલ જેણે એવા શ્રી શ્યામ નામના જિનેશ્વર
જ્યકારને પ્રાપ્ત થાએ. ॥૮૩॥

સુરાચહે દુનિય, દુનિય વણણાંમે જિણુભયણે ॥
ચઉરે આહુડ મેરે, પાસં ચ ખુણુંમિ રાડાહે ॥ ૮૪ ॥

શાસ્ત્રાર્થ:-

સુરાચંદ્ર ગામને વિષે એ જિન અવનો છે. તથા વણણું પ-તન
ને વિષે એ જિનભવન છે તેને, તથા વાગ્મણ મેડ દુગાને વિષે ચાર
જિનભવનનોને વળી રાડદહ ગામને વિષે શ્રી પાર્શ્વનાથનો. પ્રાસાદ
છે તે પણ હું સ્તવું છું. ॥૮૪॥

સિરિ કન્ન ઉજા નરબધ, કારિય ભવણુંમિ કીરદાડમણે ॥
તેરસ વંજરસદુચ્ચે, વીરજિણો જયઉ સરયઉદે ॥ ૮૫ ॥

૨૧૮૬૪૦:-

સત્યપુરને વિંશો શ્રી કાન્યકુર હેઠળા રાગનામે કારણમાં
કાન્યમય એવું કરાવેલા ભવનને વિંશો વીર ભગવાન જયને ખામો.
તે ભવન કેવું છે ? અથાં છે તેરણો વરસ જેને એવું છે. એહિં
જે વરસ સંખ્યા કહી છે, તે સર્વ આ તીર્થમાલાના કર્તાની
અપેક્ષાને જાણુંની. અર્થાત આ જાગ્રત કર્યું ને હિતસથી પૂર્વે
અપેક્ષાં વર્તની સંખ્યા વેતી. ॥૮૫॥

અડુવિઅન્ધરિયનિહી, રહેાય પહેાય પથડસાદિવે ॥

અલાલચચ્ચ ગાંડ દુજીઓ, જાલઉરે વીરજિણુ ભવણે ॥૮૬॥

૨૧૮૭૦:-

જાવલિપુર ન્યરને વિંશો શ્રી વીરજિન ભવનમાં વણા પ્રકારના
આર્થના નિધિરૂપ એવો રથ છે. ત્યાં જે સમયને વિંશે રથયાત્રા
થાય છે. તે રથ શ્રી વીર ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ છે જેમાં
એવો પોતાની મેળેજ ચાલે છે. તે માટે તે રથ પ્રકટ છે અતિરાય
જેને એવો છે. વળી એક મેળો ઢોંબ છે, તે જયારે રથયાત્રા
પ્રવર્તે છે ત્યારે પોતાની મેળે આગળ વાગે છે. એ ધંડ પણ પુરુષ
રૂપ પ્રનિમા ધારણું કરનારા એવા એવને હૃકાણું થઈને ચાલે છે.
॥૮૭॥

નવનવર્ક લખવણુંબદ અલાલચાસે સુવનનગિરિસિહરે ॥
નાહાડ નિવ કાલીલાં, શુણુ વીર જાખ વસહીએ ॥૮૮॥

૨૧૮૮૦:-

મેરુના શિખર સમાન છે શિખર જેનાં એવાં યક્ષવસતિ
તામના પ્રાસાદને વિંશો નાહાડ રૂપના વારામાં સ્થાપના કરેલા એવાં
વીર ભગવાનને હું રસું છું. સુવર્ણગિરિ શિખર કેવું છે ?

નવાણું કાખ દરબના ધ્યાણી એવા અનપીતિઓને પણ તથા મહ્યો
વાસ, જેને વિષે એવો છે. અર્થાત ઉપરના ગદને વિષે નવાણું
લક્ષ દરબના ર્થતને રહેવાને નિવાસ મદતોજ નથી પરંતુ ડેટિભજ
દ્વારા તેને રહેવા વાસ થણે છે. અર્થાત ડેટિભજ એ ખેણું રેજ
ત્યાં રહે છે. ॥૧૮॥

તાહ ચિરભન્નણે ભીએ, વહે ચંદળાહું તચેણ તચેણે
અણુધજુધુદ્વિદ્વિયાસં, કુમરવિહૃારંમિ સિરિયાસં ॥ ૮૮॥

શાસ્ત્રાર્થ:-

તથા ભીજ ચિરંતન પ્રાસદને વિષે અંદ્રપ્રભન્નામીને કું
વંદન કરું છું. તદંતર ત્રીજ અવનને વિષે તો પદી કુમારપાગ
રાજએ નવા રચેતાં એવા અવનને શ્રી પાર્શ્વનાથને વંદન કરું છું
તે પાર્શ્વનાથ કેવા છે? પ્રણામ કરનારા લોકોની પુરી છે આશા
નેણું એવા છે. ॥૮૮॥

અંલેનિ પહીલ નાણુથ, હેતુણું હેસુ વીરનાહરસ ॥
પથપડિમજુયલ અંકિય, થૂલજુએ ચેદુએ વહે ॥૮૯॥

શાસ્ત્રાર્થ:-

અંલણુવાડ ગામને વિષે તથા પાલી ગામને વિષે તથા નાણુક
ગામને વિષે અને હેવાનંદી ગામને વિષે શ્રી જિનનાં એ પગલાંએ
કરી પવિત્ર અને અંકિત એવો જે સુલ, તેણે યુક્ત એવા શૈલ્યોને
કું વંદન કરું છું. ॥૮૯॥

મેવાડ હેસળામે, થુણુમિ લાંજિદ નંદિસમનામે ॥
સગડાલમાંતિ કાર્યિ, જિણુમનણે નાયકુલતિલય ॥૯૦॥

૧૮૦૩૧૨:-

મેહયાપ હેશ ગમનો વિંંસ, નંદીસહ ગમને વિંસ શ્રી સુયુવાલ
અનુભૂત પિતા એવા સક્રાતમંત્રિયે કરાવેલા શ્રી જિત અવતને વિંંસ
શાતકુલના શૃંગારરૂપ એવા શ્રી વીર લગ્બાનને અડિતથી હું સુનિ
કરું છું. ॥૮૦॥

ચુક્કોસલ મુણિસુયદ્વિય, પવિત્રસિહુરંમિ મુળગલગિરિંમિ ॥
સંખ્ય ચિત્તઉંડાએ, ચિરતર ઘણુચેદાએ થુણિમ્ભા ॥૮૧॥

૧૮૦૪૧૨:-

મુહગલ નામા પર્વતને વિંસ લાલ ચિત્તકુટ ચિતોડગઢને વિંસ
પ્રાણીન સમયનાં વણું ચૌલોને અમે સ્તરીયે છીએ. હવે એ ચિત્ત-
કુટ નામનો પર્વત કેવો છે ? ચુક્કાશલ સુનિનાં ડડા મમની ગમને
કરી પવિત્ર થયેલાં છે શિખર જેનાં એવો છે. એ તીર્થનો વીરતાર
ચુક્કાશલ સુનિનાં કથાથી જણાવો. ॥૮૨॥

અણખૂયગિરિવરસિહુરે, જિણુલવણું વિમલઠાવિયં વિમળં ॥
વિમલપિચેહું દસહિં, ગયંદસહેહિં કયમહિમં ॥૮૩॥

૧૮૦૫૧૨:-

આખુ નામના ગિરિવરના ચિખરને વિંસ વિમલમંત્રિયે
કરવેલું જિત અવત છે. તે કેવું છે ? ઉજવાના કાતિયુક્ત છે.
નલી કેવું છે ? ગનેંદ્રની ઉપર ઐકેલા દશ વિમલના પૂર્વજ પુણ્યાં
એ કર્યોં છે મહિમા જેનો એનું અર્થાત ત્યાં પ્રાસાદની આગલ
અશ્વ ઉપર ઐહોલો વિમલમંત્રી હાર્થી ઉપર ઐકેલા એવા પોતાના
દશ પૂર્વજે તેણે પરિકૃત એવો પ્રલુને સેવન કરે છે. આ પ્રમાણે
અત્રધારે લિખિત એવી સર્વો જણાની પ્રતિમાણો ઉલ્લિખિત હેખાય
છે. ॥૮૪॥

અધરમમદ વિસાલં, મહિદ્વિયં સુરક્ષયં પાણિદ્વા ||
વરજિષુભવણં ભીયં, તચ્છ સિરિ વરષુપાલક્ષયં || ૬૩

શાન્દર્થ:-

તેજ આખુ ઉપર શ્રી વસુપાણે કરાંદું એવું ખાજું
ઉત્તમ જિનભવન દેવતાએએ જણે કરેલું હોય નહીં એમ શોભે
છે. તે કેવું જિનભવન છે ? અત્યંત મનોદર છે, તથા અત્યાત
મોડું અને સુર્ખુંકલશરૂપ રીખ્ધાએ યુક્ત એવું છે. ॥૬૩॥

ધોયકલધોય નિમિભય-પયંડ ધ્યદંડ ભંડિયં ઉલયં ||
વરસાયકુંલ, ગયદંલ, કુંલસોલાંત થુલગાં || ૬૪ ||

શાન્દર્થ:-

ગાલેલું, શોંખલું એવું જે સુવર્ણ તેને કરી નિર્માણ કરેલો
એવો પચંડ જે ધ્વજદંડ તેણે કરી સુરોભિન તથા વરસાતકુંલ
જે સુવર્ણ તેના ગતદંલ તે જે છલરહિત કુંલ જે કલશ તેણે
કરી સાંધીક છે રતુપાણ જેનાં એવા એ ચૈત્યો છે. ॥૬૪॥

પદમ જિષુભવણ જરૂરનિહિ-ગરૂ ચિંતામણિં થુણે ઉસલં ||
અવર વરભવણ સુરગિરિ,-તડિ અમરરસય નેમિ જિષું ॥૬૫॥

શાન્દર્થ:-

પૂર્વોક્ત જે એ ચૈત્ય તેમાં પ્રથમ જિનભવનરૂપ જરૂરનિહિના
ગર્ભને વિષે ચિંતામણી સમાન એવા શ્રી ડ્યુલદેવને હું રૂતિ
કરું છું. ભીજ મનોદર છે ભવન જેમાં એવા સુરગિરિતને વિષે
કરૃપદુલજ જણાયે હોય નહિ ? એવા શ્રી નેમિ જિનતે હું
જાણું છું. ॥૬૫॥

નયાણદુગં વ સુરાર્દ, સિરિથર જીયલં વ રયાણપદિપુલં ॥
એહાઈ જિયાભવણદુગં, અણખુપગિરિધર નરિંદસસ ॥ ૬૬ ॥

શાલાધાર્થ:-

આણુગિરિધ રાજ તેના, રૂડી છે કિચાયો જેમાં એવા જાણે
એ નયનોન હોય નહિ ? એવા જે જિનલક્ષ્યન શોભે છે. તથા
રત્નોયે કરી પરિપૂર્ણ એકું સુશોભિત એવા રાજના એ ભાડારજ
જાણે હોય નહિ ? ॥૬૬॥

અણખુઅગિરિધરમૃદે, મુંઝલે નાંદિદ્રકખ અહુભાગે ॥
શુદ્ધિમાથકાલિ વીરે, અચલસરીરે ડિએ પહિમં ॥ ૬૭॥

શાલાધાર્થ:-

આણુ ગિરિધરની મુલ તવાઈને વિષે અને મુંડસ્તલ ગામને
વિષે નદિવિક્ષને અધો ગાને વિષે નિશ્ચલ છે શરીર જેનું એવા વીર
ભગવાન કેવલજ્ઞાનના લાભની પુરો કાઉસગે પ્રત્યે રહ્યા હતા.
॥૬૭॥

તો પુનરાય નામા, કોણ મહામા જિયારસ ભતીએ ॥
કારદ્ધ પહિમં વરિસે, સંગતીસે વીરજીમાએ ॥ ૬૮ ॥

શાલાધાર્થ:-

શી વીર ભગવાનના જન્મ થકા સાણીસમે વરો, કાઉસગે
રહ્યા તે કારણ માટે ત્યાં કોણ પુષ્પયરાજ નામના મહાત્મા શી
જિનતી અકિતએ કરી પ્રતિમાને કરાવી. ॥૬૮॥

કિંચ્ચાણા અઠારસ-વાસસયાએય પવરતિધ્યસસ ॥
તો ભિત્થબણસમીરં, થુણેમિ મુંઝલે વીરં ॥ ૬૯ ॥

૨૧૦૬થી:-

જે અગવાનના ઉત્તમ તીર્થને પ્રવતનાં આજ કાંઈક ઉણાં
અદારસો વર્ષ થયા તે શ્રી વીર અગવાનને મુંડસ્થલ ગામને વિષે
હું સુતિ કરું છું. તે કેવા છે? મથ્યાત્મકૃપ જે મેઘ તેને
દાદવાસાં વાયુંસમાન છે. ॥૮૬॥

મહુદ મહૂલથ અદસય નિમનલ અચ્છેરભૂય વરમુ-તી ॥
અજિય જિણેં તારણુગિરિ, કુમારનિવઠાવીએ જયઉ ॥૧૦૦॥

૨૧૦૭થી:-

યોએ તારણુગીરિને વિષે અથોત તારંગાને વિષે કુમારપાદ
રાનગે સ્થાપન કરેલા એવા અજિતજિન જય પામે.. તે અજિત
જિન કેવા છે? મહિમાના અતિશયેંએ કરી નિર્મલ એવાં આશ્ર્ય
તેણે કરી વિચિત્ર છે મૂર્તિ નેતી એવા છે. ॥૧૦૧॥

વાયડનયરે મુણિસુ-વયરસ શુદ્ધાત્મિપદિમહું ॥
વાંદે તહુ વીરજિણું, સનદ્ધસં વન્ધદર સયા જરદ ॥૧૦૨॥

૨૧૦૮થી:-

હું વાયડનગરને વિષે મુનિસુવતસ્વામિની જીવતા છતાં સ્થાપત
કરેલી એવી મુનિસુવતસ્વામિની પ્રતિમાને વંદન કરું છું. તથા તેજ
વાયડનગરને વિષે વીર જિનને હું વંદન કરું છું. તે જિન કેવા
છે? નેતે સ્થાપન કર્દાને સન્તરસો વર્ષ થયાં છે. ॥૧૦૩॥

તહુ સિરિમાલા રાસણુ, અંભાણાણં હ સિદ્ધિપુરપસુહે ॥
કાસદહુ અજમાહુર, પુરેસુ ચિરચૈદએ થુણુમો ॥૧૦૪॥

૬૧૮૯૨૦:-

(૧) શા ભિન્નમાલ, (૨) આરસણુપુર (૩) આદમણુપુર
 (૪) આનંધપુર (૫) સિદ્ધધ્યુર પ્રમુખ સ્થાનોને વિષે, તથા કાંઈક
 અને અવજાહપુરને વિષે એટલા સ્થાનકે ઘણાં કાળનાં પુરાણાં
 ચૈત્યોને અમે રતુંતિ કરીએ શીએ. ॥૧૦૨॥

ગુજરાત માલય કુંકણુ, મહુરઠ સોરઠ કંછ પાંચાલે ॥
 મરુ સંભરિ મહુરાઉરિ, હથીણુપુર સોરિય પુરાધ ॥૧૦૩॥

૬૧૯૦૨૦:-

ગુર્જરહેશ, માલવહેશ, કેંકણહેશ, મહારાષ્ટ્રહેશ, સૌરાષ્ટ્રહેશ,
 કંછહેશ, પાંચાલહેશ તથા મહિદેશ, શાકંભરી નગરી અને મધુરાપુરિ
 હરિતનાપુર, સોરિયપુરાહિને વિષે. ॥૧૦૩॥

તિહુઅણ ગિરિગોવાંગિરિ, કાસિ અવંતી મેવાડ માછસુ ॥
 હેસેસુ જિણે શુણિમે, દિઠ અદિકે સુઅ અસુઅ ॥૧૦૪॥

૬૧૯૧૨૦:-

તરા ત્રિભુવનગિરિદુર્ગ અને ગોવગિરિ દુર્ગ ને જાતીયર તેને
 વિષે અને કારી તથા અવંતી નગરી અપે મેદ્પાટાદિ એવા દેશનોં
 વિષે દીકેલા અને નહિ દીકેલા તથા સાંભળેલા અને નહિ સાંભળેલા
 એવા જિનોને અમે સ્તવીએ શીએ. ॥૧૦૪॥

તહ જંખુદીપ ધાયાદ, પુટભરદીવહૃ વિજયસનરિસાએ ॥
 જે કેદ ગામાણરનગ નગરાદ્ય તહિયં તુ ॥૧૦૫॥

૬૧૯૨૨૦:-

તથા જંખુદીપને વિષે, ધાતકીઅંડને વિષે પુષ્કર વર કીપાદ

ને વિંયે, એમાં સર્વ ભક્તા એકસોને સિન્નેર વિજય છે તેને વિંયે
જે કુાધ આમ, વેવાકલાદિક, પર્વતો તથા પુરાદિક, આદિ શાન્દ
અન્ય અનિવેશો પણ અદણ કર્યા. તે સ્થવોને વિંયે રહેલા
પ્રતિમાઓને ॥૧૦૫॥

જાણુ ગિહુચ્યાદ્યાણિય, જાણુ ય જિણુભવણુ તેમું જ પડિમા ॥
બૃદ્ધાં જાપણુચ્યાસય, લાહુઅા અંગુઠપહસમા ॥૧૦૬॥

શાન્દાર્થ:-

અને જે ગુદ હેડલય, વક્તા જેટલાં જિત ભવનો નેને વિંયે
એંચાચ્યો ધનુષ પ્રમાણુ મોડી અને અંગુઠના પવો જેવી નાની
એવી પ્રતિમાઓને નેને. ॥૧૦૬॥

સુરનરક્ય મણિકંચળુ-રીરી રૂપાઈ જાન લિખ્ય અયા ॥
છઉમદરેહુ અમુણિય, સાખાઉ નમામિ તા સન્યા ॥૧૦૭॥

શાન્દાર્થ:-

દેવતાઓએ તથા મનુષોએ કરેલા એવા મણિરન, કાંચન,
પીતલ, રમું ધત્યાદિકની આદિ પદ થકી યાવત કા'ટ પાણાણાદિક
ની, તથા દોપમય એવી તથા આપણુ સમાન છલસ્થ પુરુણોએ,
નહિ જણેલી છે સંખ્યા જેમની એવા જે પ્રતિમા છે ને સર્વ
પ્રતિમાઓને હું નમન કરું છું. ॥૧૦૭॥

કે દુધ તિથ્યયરા, જે ય ભવિસસા અણુગાએ કાલે ॥
યભ વિજે સાચિ વહુમાણા, તે સંદે ભાવયા નમિમો ॥૧૦૮॥

શાન્દાર્થ:-

ને અતીત કાલને વિંયા થયા એવા તીર્થિકર વક્તા ભવિષ્ય
કાળને વિંયે ને થશે અને જે વર્તમાન કાલમાં વર્તતા એવા ને

તिर्थं કર તે સર્વને ભાવ થકા નમાયે શીંગે. ॥૧૦૮॥

સુરક્ષયમણુચ્યક્ષયં વા, લુચણુતિગે સાસયં ચ જં તિર્થં ॥
તં સયલ ભિહડિઓવહુ, મણુવયણુ તણુહિં પણુમાભિ ॥૧૦૯॥

શાખાર્થ:-

તણુ લુચનને વિંશ દેવતાઓએ કરેલું અથવા મનુષ્યનું
કરેલું વળી ને શાશ્વત એવું તાર્થ છે, તે સકળ તાર્થને ભન,
અને કાયાએ કરી આદિંજ રહ્યો એવો પણ હું પ્રણામ કરે
છું. ॥૧૦૯॥

જર્થં જિણુણં જર્મેા, હિકાય નાણું નિસીહિચા આસી ॥
જયં ચ સમેસરણં, નાયો ભૂમિયા વંદાભિ ॥૧૧૦॥

શાખાર્થ:-

જે ભૂમિને વિંશ સર્વ જિતોનો જન્મ થયો હોય, દીક્ષા
લીધા હોય કેવક્ષાન ઉપજનું હોય, નીરાણુ થયું હોય તથા જ
શા જિતોનું સમવરણ થયું હોય તે સર્વ ભૂમિઓને હું નમન
કરું છું. ॥૧૧૦॥

એવમસાસય સાસય, પડિમા શુલ્લિયા જિણિંદ્વચંદાણં ॥
સિર્દિભંહિંહલવણં-દ ચંદુલિયંહદૃદ્ય ભહિયા ॥૧૧૧॥

શાખાર્થ:-

એ પ્રકારે જિતોનું દ્વચંદ્રની શાશ્વતી અને અશાશ્વત એવી
પ્રતિમાઓ તે મેં સ્તવી. તે પ્રતિમા કેવી છે? સુશોભિત એવા
મહેંદ્ર જે વૈમાનિક અને ભવેંદ્ર તે પાતાલવાસી હેવો તથા હેવેંદ્રે
તેણે તથા ચંદ્ર અને મુનિવુંહ તેણે સ્તવ્યો છે. મહિમા જેતો એવા
છે. આદિં કરીએ વરી પોતાનું મહેંદ્રસિંહસુરિ એવું નામ પણ
આ ગાથામાં સ્વચન કર્યું છે. ॥૧૧૧॥

સ મા મુ.

૩૬

